



જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૩/૧૨/૨૦૧૮ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૩૪૮/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૯ કેસ કરી, ૨૬ વ્યક્તિઓને ઝડપી, ૧૫૮ લીટર દેશી દારૂ, ૧ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૧ સ્ફૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૨૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૪,૫૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૩૪૯/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૬૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપિંડી અને વિશ્વાસઘાત :-

સમાચાર યાદી નં.૨૩૫૦/૧૮

એરપોર્ટ: જગદીશભાઈ ફતેસિંહ સોલંકી (ઉ.વ.૩૪)(રહે. ગામ- આબદેલા, રાપી વિસ્તાર, મિત્રાલ રોડ, તા- નડીયાદ જી-ખેડા) એ તા.૨/૧૨/૧૮ નારોજ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે માહે જુલાઈ-૨૦૧૮ થી તા.૧૭/૯/૧૮ કલાક ૧/૩૦ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી મિલાવ સંઘવી (જેના પુરા નામ સરનામાની ખબર નથી)(ઓફીસ : સુરેસોર્સ વિઝા-૭ સીસ પ્રાઇમાઇટ મધર ડેરી સામે બોકડદેવ) એ જગદીશભાઈ તથા સાહેબને વિશ્વાસમાં લઈ ગ્રીસ કંટ્રીમા ફરવા જવાના વિઝા કઢાવી આવવાની લાલચ આપી, વિઝા માટેના ડોક્યુમેન્ટ મેળવી, ડુપ્લીકેટ વિઝા તૈયાર કરી, બંને પાસેથી ત્રણ-ત્રણ લાખ રૂપિયા મેળવી લઈ વિશ્વાતઘાત અને છેતરપિંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.બી.પ્રજાપતી ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૨૩૫૧/૧૮

વસ્ત્રાપુર : વંદનાબહેન વા/ઓ દીલીપભાઈ કોટાઈ (રહે. શક્તિનગર ગાંધીધામ કચ્છ) એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૨/૧૨/૧૮ બપોરના ૩/૦૦ વાગ્યાના સુમારે ગુરુકુળ રોડથી ઘાટલોડીયા તરફ જવાના રસ્તા પર આવેલ સહેલી નામના શો રૂમ ખાતે ચેન્જીંગ રૂમમાં ડ્રેસ ચેન્જ કરવા માટે ગયા હતા ત્યારે સોનાનું કડું કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦/- અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.કે.મકવાણા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૩૫૨/૧૮

નારોલ: ઇલાબહેન વા/ઓ રઘુવીરભાઈ તૈલી (ઉ.વ.૬૬) (રહે. સ્વામીનારાયણ પાર્ક-૨ કર્ણાવતી-૧ ની બાજુમાં નારોલ) એ અગમ્ય કારણસર તા.૧/૧૨/૧૮ બપોરના ૪/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પોતાની જાતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી સળગી ગયા હતા. સારવાર માટે તેમને એલ.જી.હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨/૧૨/૧૮ કલાક ૦૦/૦૫ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી જે.બી.રાઠોડ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.